

આજથી એક વર્ષ પહેલા વરાછા, કૃષ્ણનગર સોસાયટીનારીપુલ કોમ્પલેક્ષમાં આવેલ વકીલની ઓફીસના તાળા તોડી રોકડા રૂ.૧.૭૮ લાખની ચોરી કરી નાશી જનાર રીઢા ઘરફોડીયાનેઝડપી પાડી, ઘરફોડ ગુનાનો ભેદ ઉકેલતી, સુરત શહેર કાર્ધમ બ્રાંચ.

સુરત શહેરના વરાછા પો.સ્ટે. વિસ્તારમાં કાર્ધમ બ્રાંચના પો.સ.ઈ.શ્રી હિલ્પા સીંધા નાઓ તથા સાથેના પોલીસ માણસો સાથે શહેર વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હે.કો.હરીસિંહ વિરસંગભાઈ તથા હે.કો.હરપાલસિંહ જશુભા નાઓને મળેલ બાતમી આધારે કાપોદ્રા પાણીની ટાંકી પાસેથી રીઢા ઘરફોડીયા જનક ઉર્ફે કાળીયો ચતુરભાઈ સોલંકી, ઉ.વ. ૩૨, રહે. લસકાણા, બાપા સીતારામ હોલની સામે, રમેશભાઈ ભરવાડની બિલ્ડીંગના ધાબા ઉપર પતરાની રૂમમાં, સુરત. મુળ વતન- ધોલેરા, ખુણ વાળા રોડ ઉપર નવી બિલ્ડીંગની બાજુમાં, તા. ધંધુકા, જી.અમદાવાદવાળાનેઝડપી પાડેલ, મજકુર આરોપીની પુછપરછમાં વરાછા કુટપાથ ઉપર મચ્છરદાની અને ટેબલ વેચવાનો ધંધો કરતો હોય, આજથી દોઢેક વર્ષ પહેલા સુરત, મ્યુનિસિપાલિટીના દબાણ ખાતાવાળા તેનો ત્રણ ચાર વખત માલ જમા લઈ લેતા તે દેવાદાર થઈ ગયેલો હોય, જેથી ઘરફોડ ચોરી કરવા માટે આજથી એકાદ વર્ષ પહેલા દિવસ દરમ્યાન વરાછા રોડની સોસાયટી અને એપાર્ટમેન્ટોમાં આંટા ફેરા મારી, રેકી કરવા લાગેલો અને વરાછા રોડ, લક્ષ્મી હોટલની બાજુમાં એક એપાર્ટમેન્ટમાં બીજા માળે એક ઓફીસ હતી તેમાં રાત્રીના સુમારે ચોરી કરવાનું નક્કી કરી ઓફીસના તાળા તોડી, ટેબલના ખાનાઓમાંથી રોકડા રૂ.૧.૮૦ લાખ ચોરી કરેલાની કરેલ કબુલાત આધારે ખાત્રી કરતા વરાછા પો.સ્ટે. I-ગુ.ર.નં.૫૪/૨૦૧૯ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુનો નોંધાયેલ હોય, તેમજ નીચે મુજબના ગુન્હાઓમાં સંડોવાયેલ હોય, જે વણશોધાયેલ હોય, જે શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

આરોપીનો પુર્વ ઇતિહાસ:-(૧) કાપોદ્રા પો.સ્ટે.I-૨૪૦/૨૦૧૭ ઈ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ. (૨) વડોદરા કારેલીબાગ પો.સ્ટે. I-૦૫/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ.(૩) વડોદરા બાપોદ પો.સ્ટે.I-૨૬/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ. બે વખત પાસા હેઠળ રાજકોટ તથા જામનગર જેલમાં પણ જઈ આવેલ છે.